



1. કેન્દ્ર સરકારના અંદાજપત્રના ડિસાબી ખાતાઓની વિગતે ચર્ચા કરો.

- કેન્દ્ર સરકારનું અંદાજપત્ર દેશના નાણાંમંત્રી લોકસભામાં મંજૂરી માટે જેતે વર્ષના ફેબ્રુઆરી માસની અંતિમ ક્રિતારીખે રજૂ કરે છે.
- કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં ખર્ચનું વર્ગીકરણ આયોજિત અને બિનઆયોજિત ખર્ચ તરીકે થાય છે.



2. રાજ્ય સરકારના અંદાજપત્ર ઉપર ટૂંક નોંધ લખો.

- રાજ્ય સરકારના અંદાજપત્રમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચનું વર્ગીકરણ વિકાસલક્ષી ખર્ચ અને બિનવિકાસલક્ષી ખર્ચ તરીકે થાય છે. ઐતી, ઉધોગ, સિંચાઈ વગેરે પાછળનો ખર્ચ વિકાસલક્ષી ખર્ચ છે. જેનો હેતુ વિકાસને વેગ મળે તે જોવાનો છે.
- બિનવિકાસલક્ષી ખર્ચ જેવાં કે વહીવટી સેવાઓ, પેન્શન અને નિવૃત્તિના લાભ વગેરે ખર્ચ. આવા ખર્ચ દેશના વિકાસ માટે નથી થતા, પરંતુ તે દેશના લોકોનાં જીવનધોરણ સુધારા માટેનું માળખું તૈયાર કરે છે. રાજ્ય સરકારનું બજેટ ખૂબ મર્યાદિત સાધનોના સંદર્ભમાં રજૂ થાય છે.

રાજ્ય સરકારનું મહેસૂલી ખાતું	
આવક	ખર્ચ
<p>1. કેન્દ્રિય વેરન્મથી મળેલો હિસ્સો</p> <p>2. રાજ્ય ના કરવેરાની આવક:</p> <p>જમીન મહેસૂલ સ્ટેમ્પ ડયુટી, વચ્ચનવેરા, વાહનવેરો, વીજળી વેરો, મનોરંજન કર વગેરે.</p> <p>3. અન્ય આવકો</p>	<p>વિકાસલક્ષી ખર્ચ:</p> <p>(1) સામાજિક સેવાઓ જેવી ક શિક્ષણ, આરોગ્ય, માહિતી પ્રસારણ, પછાત વર્ગ કલ્યાણ વગેરે પાછળનો ખર્ચ.</p> <p>(2) આર્થિક સેવાઓ જેવી કે ઐતી, ઉધોગ, સિંચાઈ, પરિવહન, સંચાર, ગ્રામીણ વિકાસ વગેરે પાછળ નો ખર્ચ.</p> <p>બિનવિકાસલક્ષી ખર્ચ:</p> <p>સમાન્ય સેવાઓ જેવી કે વહીવટી સેવાઓ, પેન્શન અને નિવૃત્તિના લાભ જેવી અન્ય સેવાઓ પાછળના ખર્ચ.</p> <p>અન્ય ખર્ચ : નીચેના સ્તર ની સંસ્થાઓના અનુદાન</p>

રાજ્ય સરકારનું મહેસૂલી ખાતું	
આવક	ખર્ચ
<p>1. જાહેર દેવા:</p> <p>(1) રાજ્ય સરકારનું આતરિક દેવું</p> <p>(2) કેન્દ્રની લોન અને પેશાગીઓ</p> <p>(3) સાધનો માટેની પેશાગી</p> <p>2. અન્ય સરકારની લોનો અને પેશાગીની વસૂલાત</p> <p>3. અન્ય મૂડી- આવકો</p>	<p>વિકાસલક્ષી ખર્ચ:</p> <p>(1) સામાજિક સેવાઓ પાછળ થતો મૂડી-ખર્ચ</p> <p>(2) આર્થિક સેવાઓ પાછળ થતો મૂડી- ખર્ચ</p> <p>બિનવિકાસલક્ષી ખર્ચ:</p> <p>(1) સમાન્ય સેવાઓ પાછળ થતો મૂડી- ખર્ચ</p> <p>(2) જાહેર- દેવાની ચુકવણી</p> <p>અન્ય ખર્ચ:</p> <p>રાજ્ય દ્વારા અન્ય સરકારો ને લોન અને પેશાગી</p>

3. રાજ્ય સરકારના મૂડી ખાતાની આવક અને ખર્ચ બાજુની વિગત જણાવો.

